



જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૫/૧૦/૨૦૧૮ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૦૧૩/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૭૩ કેસ કરી, ૭૨ વ્યક્તિઓને ઝડપી, ૧૬૫ લીટર દેશી દારૂ, ૫૦ બોટલ ઇંગ્લીશ દારૂ, ૪૫ બિયર ટીન અને ૧ કાર કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૮ કેસ કરી ૬૩ વ્યક્તિઓની અટક કરી રોકડ રૂપિયા ૧,૧૪,૨૨૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૦૧૪/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૦૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી તેમજ પ્રોહી ૯૩ મુજબ ૨ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીંડી અને વિશ્વાસઘાત :-

સમાચાર યાદી નં.૨૦૧૫/૧૮

એરપોર્ટ: રાજેન્દ્રકુમાર ભીખાલાલ પટેલ (ઉ.વ.૪૩) (રહે. અક્ષત એલીગંજ દર્શન એપાર્ટમેન્ટ પાસે અવસર પાર્ટી પ્લોટ પાછળ હાંસોલ) એ તા.૧૪/૧૦/૧૮ નારોજ એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૮/૦૮/૧૮ તથા તા.૨૯/૦૮/૧૮ નારોજ આરોપી મો.ન.૯૫૮૨૦૫૫૮૬૭ તથા વોટસઅપ નંબર ૮૮૮૨૨૬૧૬૫૨ ના ધારકે ભેગા મળી ઇન્ડિયા ટુડે હોલીડે માંથી વાત કરૂ છુ તેમ કહી, રાજેન્દ્રકુમાર પટેલે એક વર્ષ પહેલ હુડાઇ કંપનીની આઈ-૧૦ ગાડી ખરીદેલ જે બાબતે સેમસંગ ટી.વી. તથા ફરવા જવાના મળી બે પેકેજ મળે છે તેમ કહી રાજેન્દ્રકુમાર પટેલ પાસેથી અલગ-અલગ રૂપિયા ૫૯૯૯/- તથા રૂપિયા ૩૫૦૦/- રાજેન્દ્રકુમાર પટેલના ખાતામાંથી ઓનલાઇન ટ્રાંજેક્શન કરાવી પેકેજ નહી આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ હે.કો.શ્રી વિશ્રામભાઇ ચલાવે છે.

ધરફોડ:-

સમાચાર યાદી નં.૨૦૧૬ /૧૮

એલીસબ્રીજ: હીતેશભાઇ જશવંતભાઇ શાહ (રહે. સ્વાતી એપાર્ટમેન્ટ-૨ ડીમાર્ટ પાછળ ટી.વી.-૯ ની ગલીમાં જીવરાજ પાર્ક) એ એલીસબ્રીજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૩/૧૦/૧૮ બપોરના ૨/૪૫ વાગ્યાના સુમારે એલીસબ્રીજ નેહરૂનગર એચ કોલોની પતંજલી સ્ટોર નામની દુકાનના શટરના તાળા ખોલી અજાણી વ્યક્તિ દુકાનમાંથી કુલ રૂપિયા ૧,૦૦,૬૩૯/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એ.પી.જેબલીયા ચલાવે છે.

દાજી જતાં મૃત્યુ :-

સમાચાર યાદી નં.૨૦૧૭/૧૮

આનંદનગર: તા.૧૨/૧૦/૧૮ કલાક ૪/૩૦ વાગ્યાના સુમારે પ્રવિણભાઈ હરખાભાઈ મકવાણા (રહે. કૃષ્ણધામ ઔડાના મકાન વિભાગ-૨ વેજલપુર) ના ઘર પાછળ આવેલ કચરાપેટીમાં અચાનક આગ લાગતા પ્રવિણભાઈનો પુત્ર વંશ (ઉ.વ.૮) દાઝી ગયો હતો. સારવાર માટે તેને સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે આનંદનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી અહેમદખાન અબ્દુલખાન ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૨૦૧૮/૧૮

શહેરકોટડા: કમલજીતસિંગ યોગેન્દ્રસિંગ ક્ષત્રિય (ઉ.વ.૪૩) (રહે. અરવિંદમિલની ચાલી અનિલ સ્ટાર્ચ રોડ પિકર્સની ચાલી પાસે સરસપુર) એ અગમ્ય કારણસર તા.૧૪/૧૦/૧૮ બપોરના ૪/૪૫ વાગ્યા પહેલા પોતાના ઘરે લોખંડની પાઇપ સાથે દોરી બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે શહેરકોટડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી હમીરભાઈ અણસીભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.